

**વિષયસૂચિ :**

- |  |  |
|--|--|
| ૧.૦ બળાત્કાર કે જાતીય હિંસા અંગે પ્રાથમિક માહિતી | ૪.૦ જ્યારે તમારા પર જાતીય અત્યાચાર થાય ત્યારે    |
| ૨.૦ બળાત્કારથી બચવા માટે શું કરશો                | ૫.૦ જ્યારે કોઈ સ્ત્રી પર બળાત્કાર થયો હોય ત્યારે |
| - જાણીતા પુરુષનો બળાત્કાર રોકવા માટે             | ૬.૦ બળાત્કારથી ઊભી થતી આરોગ્ય સમસ્યાઓ            |
| - બાળકો કેવી રીતે બચી શકે                        | ૭.૦ પરિવર્તન માટે પ્રયાસ                         |
| ૩.૦ આત્મસુરક્ષા અને સ્ત્રીઓ                      |  |

## ૧.૦ બળાત્કાર કે જતીય હિંસા અંગે પ્રાથમિક માહિતી

સ્વીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે જતીય સંપર્ક કરવો તેને જતીય હિંસા કહેવાય છે. સ્વીની ઈચ્છા વિરુદ્ધ પુરુષ પોતાનું શિક્ષ, આંગણીઓ કે અન્ય વસ્તુ સ્વીની યોનિમાં, ગુદામાં કે મોદામાં ધુસાડે તેને બળાત્કાર કહેવાય. કેટલાક લોકો એમ માને છે કે જબરજસ્તીથી થતો જતીય સંપર્ક પણ જે સ્વીએ દેખીતો વિરોધ ના કર્યો હોય, તેનાથી નાસી જવાની કોશિશ ના કરી હોય, તેને બેભાનાવસ્થા ના હોય કે તેના શરીર પર સંધર્ષ કરવાથી ઈજાઓ ના થઈ હોય તો બળાત્કાર કહેવાય નહીં. પરંતુ આ વાત ખોટી છે.

પુરુષ સ્વીને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે કે તેને ડરાવીને પોતાનું કામ કઢાવવા માંગે છે તે બળાત્કાર થવાનું મુખ્ય કારણ છે.

અપંગ, નિરાશ્રીત, બેઘર, ફૂટપાથ પર રહેતી, ધુદ્ધનો ભોગ બનેલ, બહેરી-મૂંગી, અંધ, મંદબુદ્ધિની, વેશ્યાવ્યવસાય કરનારી, કેદી તરીકે જેલમાં હોય તેવી, કે જેના પતિ દ્વારા અથવા મિત્ર દ્વારા સત્તાવાયેલી કે હડ્ધૂત થયેલી, દવાખાનામાં દાખલ થયેલ, વગેરે સ્વીઓને બળાત્કાર થવાની સંભાવના વધુ છે.

### સ્વીઓ પર કરવામાં આવતી વિવિધ પ્રકારની જબરજસ્તી :

સ્વીઓ પર વિવિધ સંનેગોમાં જતીય આકમણ કરવામાં આવે છે. પણ લોકો આવી બધી હરકતોને બળાત્કાર નથી કહેતા જેમ કે,

- \* પરણેલી સ્વીએ તેના પતિ સાથે જતીય સંબંધ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ એવી માન્યતા છે. તે તેના પતિનો અધિકાર છે એવું સમાજમાં સ્વીકારાયેલું છે. પણ આ વાત બરાબર નથી. સ્વીને પણ પોતાની ઈચ્છા હોય છે જ અને તેને પણ ના કહેવાનો અધિકાર છે.
- \* કોઈ પણ સંબંધમાં જતીય સંપર્ક કરવાની ના કહેવાનો સ્વીને અભાદ્ય અધિકાર છે. જે તે ના પાડે તો પછી પુરુષે તેની વાત માની લેવી પડે છે. ધણીવાર તે સ્વી માની જય તેવા પ્રયત્નો કરે છે કે પછી તેની પર જબરજસ્તી કરે છે. આવા સંનેગોમાં કેટલીકવાર ‘ના’ કહેવાનો કોઈ અર્થ નથી એમ સ્વીને લાગતું હોય તો પણ આ સંબંધ તેની ઈચ્છા વિરુદ્ધનો છે માટે તેને બળાત્કાર જ ગણવો જોઈએ.
- \* કેટલીક સ્વીઓને જીવવા માટે જતીય સંબંધ કરવો પડે છે. જ્યારે પણ સંનેગોને કારણે સ્વી પૈસા લઈને શારીરિક સંબંધ કરે છે ત્યારે તે પણ બળાત્કાર કહેવાય છે.

સ્વીઓ પર થતી હિંસાનું સૌથી ખરાબ સ્વરૂપ બળાત્કાર છે. તે માટે સ્વી પોતે જવાબદાર નથી.

ઓળખીતા પુરુષને સંબંધ માટે ના પાડવાનું સ્વી માટે ખૂબ મુશ્કેલ હોય છે.  
કારણ તેને ફરીને ભળવાનું થતું હોય છે. અથવા  
તેની સાથે ફરીને કામ પડે છે.



- \* છોકરીઓને તેના પુરુષમિત્રો જુદા જુદા કારણસર જતીય સંબંધ કરવાની ફરજ પાડે છે. દા.ત. “મેં તારે માટે હરવા-ફરવા પર કે બેટ લાવવા માટે પૈસા ખર્ચ્યા છે,” “હવે, તેં જ મને લલચાયો છે ને હવે તું કેમ ના પાડે ?”, “અગાઉ તો તેં ના નહોંતી કહી...” વગેરે. આવી દરેક વાતમાં જે આ સંબંધ છોકરીની ઠચ્છા વિરુદ્ધ થતો હોય તો તેને બળાત્કાર જ કહેવાય.
- \* નોકરીમાં ચાલુ રહેવા માટે સ્વીઓએ પોતાના ઉપરી કે સાથી સાથે શારીરિક સંબંધ રાખવો પડે છે. આ પણ બળાત્કાર છે.
- \* નાના બાળકોને ઘણીવાર જતીય હિંસાના ભોગ બનવું પડે છે. પિતા, કાકા, મોટાભાઈ, પાડોશી કે બીજા કોઈ કુટુંબીજન તરફથી આવું કરવામાં આવે છે. ઘણીવાર બાળકોને સમજાણ નથી પડતી કે આ વ્યક્તિ તેની સાથે શું કરી રહ્યો છે ત્યારે તે વિરોધ નથી કરતા. ઘરના બીજા માણસોને પણ આની ખબર ઘણીવાર નથી હોતી. જ્યારે ખબર પડે ત્યારે તેઓ એ માનવા તૈયાર નથી હોતા અને ઘણી વાર બાળકનો જ વાંક કાઢે છે. આ કદી બરાબર નથી.
- \* અજાણ્યા માણસો ધ્વારા કરવામાં આવતા બળાત્કારના પ્રસંગો જાણીતા માણસોએ કેલેલા બળાત્કારની સરખામણીમાં ઓછા છે.
- \* સામૂહિક બળાત્કાર : એક થી વધુ પુરુષો ભેગા થઇને એક સ્વી પર વારા ફરતી બળાત્કાર કરે છે. ક્યારેક જુવાન છોકરાઓ ટોળકી બનાવીને પોતાનું પૌરુષત્વ પુરવાર કરવા કે મજલ લેવા માટે એક જ છોકરીને આવી રીતે ફસાવે છે. તો કેટલીક વાર એક પુરુષ બળાત્કાર કરતો હોય તે બીજો જેઠ જ્યારે પેલાના પણી પોતે પણ તે સ્વીને બળાત્કાર કરે છે.



જે સ્વી કે બાળક પર બળાત્કાર થયો છે  
તેનો વાંક કાઢવો તે સહેતે ખોટું છે.

## બળાત્કાર અને જાતીય હિંસા

- \* કેદમાં બળાત્કાર : ગુનેગાર તરીકે પકડાએલી સ્ત્રીને પોલીસ કે બીજી રક્ષકો બળાત્કાર કરે છે. ઘણીવાર તક મળે તો પુરુષ કેદીઓ સ્ત્રી કેદી પર બળાત્કાર કરી લે છે.
  - \* યુદ્ધના સમયમાં સિપાહીઓ સામાન્ય સ્ત્રીઓને/છોકરીઓને તેમના કુટુંબીજનના દેખતાં એકલા કે સામૂહિક રીતે બળાત્કારનો ભોગ બનાવે છે. ઘણીવાર સ્ત્રીઓને તેઓ પકડી જય છે અને તેને જુંદગી બચાવવા કે તેના બાળકોના જીવ બચાવવા માટે કે ખોરાક માટે કે એવી કોઈ પણ અત્યાચારી શરતો માટે તેની પર વારંવાર બળાત્કાર કર્યા કરે છે.
  - \* કોમી રમખાણો વખતે એક કોમના માણસો બીજી કોમ પર વેર લેવા માટે તેની સ્ત્રીઓ પર જુદી જુદી રીતે બળાત્કાર કરે છે કે જાતીય અત્યાચાર ગુજરે છે.
- ૨.૦ બળાત્કારથી બચવા માટે શું કરશો ?**
- \* બને તેટલું વધુ બીજુ સ્ત્રીઓ સાથે કામ કરો. તેમની સાથે દોસ્તી કરો અને વાતો કરો. તમને સારું લાગશે.
  - \* તમને બીક લાગતી હોય તેવા માણસને તમારા ઘરમાં ના આવવા દો. તે આવી જય તો તમે એકલા છો એમ તેને ખબર ના પડવા દો.
  - \* રાતના સમયે એકલવાચા રસ્તા પર એકલા ના જશો. ને જવું જ પડે તો પૂરા આત્મવિશ્વાસ સાથે ઊંચું માથું રાખીને ચાલો.
  - \* જે કોઈ તમારી પાછળ આવી રહ્યું છે એમ તમને લાગે તો કોઈ નજીકના ઘરમાં કે દુકાનમાં જઈને મદદ માંગો અથવા તમારા જવાની દિશા બદલી નાંખો. કોઈવાર એકદમ ત્વરાથી પાછા ફરીને મોટેથી તેને પૂછો કે તે શું કરવા તમારી પાછળ આવે છે.
  - \* તમારી સાથે આત્મ સુરક્ષા માટે કાંઈ સાધન રાખો. મોટો અવાજ કરે તેવું સાધન, દા.ત. સિસોટી, લાકડી કે તેની આંખોમાં નાંખી હેવાય તેવું કશું (મરચું, મીઠું કે કોઈ રસાયણ વગેરે) સાથે રાખો.
  - \* તમારી પર હુમલો થઈ જય તો તમે તેનો સામનો કરો. તેને જેરથી જ્યાં વાગે ત્યાં મારો. શક્ય હોય તો તેના નાજુક અવયવો પર જેરથી મારો. તેમ કરવાથી તમને નાસી છૂટવાનો સમય મળશે. બચાવ કરતાં કરતાં ભૂમો પણ જરૂર પાડો.



### જાણીતા પુરુષોના બળાંકારથી બચવા માટે :

- \* તમને કોઈ પુરુષ ગમતો હશે ને તમને તેના પ્રત્યે સારો ભાવ હોય તો તે પણ સમજુને તેની સાથે વર્તન કરો. તમારા સંબંધની મર્યાદા તમે જ નક્કી કરો. શક્ય હોય તો તેની સાથે તે અંગે વાત કરો.
- \* જે તમને કોઈની સાથે સતત એમ લાગ્યા કરે કે કશુંક બરાબર નથી, તમને તેની બીક લાગે, તેની પાસેથી નાસી જવાનું મન થાય, તેની વાતો ના ગમે કે તે તમને કોઈ જગ્યાએ અડકે તે તમને ના ગમતું હોય તો ચેતી જવ. શક્ય હોય તો તેને કદક શબ્દોથી રોકો, તેનો વિરોધ કરો. આ બધું થોડુંક અધરુ જરૂર છે. પણ ઈચ્છા વિરુદ્ધ જતીય સંપર્ક કરવા કરતાં આ વધુ સારુ છે. તેમાં ઘણી વાર તમારી બહનામીનો ડર પણ તમને સતાવે છતાં મન મક્કમ રાખો અને પરિસ્થિતિનો સામનો કરો.



શું કરું ?  
આ મારી સાથે આવું કરે છે તે મને નથી ગમતું.  
પણ ના પાડીશ તો એ મારે વિશે  
કેવું ધારશે અને કદાચ મારી  
મિત્રતા છોડી દેશે તો ? જે હું આ  
ચલાણી લઈ તો તે હજુ આગળ  
વધશે અને ખબર નહિ કેવોયે  
વ્યવહાર કરશે. મને ખૂબ  
ચિંતા થાય છે કે હુએ  
મારું શું થશે ?

- \* જે વ્યક્તિ સાથે તમને આવું લાગતું હોય તેની સાથે એકલા પડવાનું ટાળો સાવ અજાણ્યા માણસ સાથે એકલા જવાનું ટાળો.

- \* કાંઈ પણ મુશ્કેલી થાય તો ધરે જવાનો રસ્તો જેઈ રાખો. સાવ અજાણી જગ્યાએ ના જાઓ.
- \* કાંઈ પણ અધિત છે એમ લાગે તો તરત ત્યાંથી નીકળી જવ.
- \* જે તે તમારો સાહેબ/ઉપરી હોય તો શરૂઆતથી જ તેનાથી ડર્યા વગર તેને આગળ વધતા અટકાવો. શક્ય હોય તો તેની સાથે એકલા પડવાનું ટાળો. તમારે તેની સાથે લાંબો સમય કામ કરવાનું હોય તો તે તમને બીજી રીતે હેરાન કરી શકે. (દા.ત. રજી મંજૂર ના કરે, વગેરે). પણ આ સંલેગોમાં તમારી સાથે કામ કરતી બીજી બેનો સાથે વાતચીત કરો. તક મળે તો તેમની મહદ્દી આ માણસને ઉધાડો પાડો.

### બાળકોની જતીય હેરાનગતિ અટકાવવા માટે :

- \* બાળકોને આ અંગે સજાગ કરો.
- \* દસ વર્ષ પછીના છોકરા છોકરીઓને જુદા સૂવડાવો.
- \* જતીય હરકત થાય તો બાળક કોની સાથે વાત કરી શકે તે પણ તેને જરૂરાવો.
- \* બાળક તમને કોઈ પણ વ્યક્તિની ફરિયાદ કરે તો તેની વાત સાચી માનીને તેને આશ્વાસન આપો.
- \* કેટલીકવાર નાની છોકરીઓને વર્ષો સુધી આના બોગ બજાવું પડે છે કારણ તેને ધમકાવવામાં આવે છે કે, જે તે કોઈને આ અંગે કહેશો તો તેને મારી નાખશો કે તેની માતા કે પ્રિય સગાંને નુકસાન થશે વગેરે.

## બળાત્કાર અને જાતીય હિંસા

### ૩.૦ સ્વીઓ માટે આત્મસુરક્ષા

નીચે દર્શાવેલ આત્મસુરક્ષાના દાવ શીખો. તેની પ્રેક્ટીસ કરો. મુશ્કેલીમાં મુકાયા હો ત્યારે આ દાવ ચાદ કરીને આત્મસુરક્ષા કરો. એક વાર તમે આ શીખી લેશો તો પછી મનમાંથી ભય જતો રહેશો અને આત્મવિશ્વાસથી તમે સામનો કરી શકશો.

જે પાછળથી હુમલો કરે તો આમ કરો.  
કોણી વડે જેરથી  
તેના પેટમાં ગોહો મારો.



તમારો હાથ પાછળ  
લઈ જાઓ અને તેની  
ગોટીઓ (વૃષણ) ને  
પકડીને જેરથી ઘેંચો



તેના પગના નળા પર  
(ઢીચણથી નીચે) જેરથી  
પાછળની લાત મારો.

જે આગળથી હુમલો કરે તો આમ કરો.  
તમારી આંગળીઓ  
જેરથી એની આંખમાં  
ખોસી હો.



બે હાથની મુઠી વાળી  
તેના લમણાં પર કાન  
પર બન્ને બાજુએ વારા  
ફરતી ગુંબા મારો.



મુઠી વાળીને જેરથી  
તેના નાક પર મારો.



તમારા ઢીચણ વડે  
જેરથી તેની ગોટીઓ  
(વૃષણ) પર મારો.

#### ૪.૦ જ્યારે તમારા પર જાતીય અત્યાચાર થાય ત્યારે

સામાન્ય રીતે હુમલો થાય ત્યારે તમે જેટલો વધુ વિરોધ કરો તેટલું તમને શારીરિક નુકસાન અને માનસિક આધાત ઓછો લાગશે. ઇતાં જ્યારે હુમલો કરનાર કોઈ હથિયાર લઈને તમારી ઉપર જબરજસ્તી કરે તો તમે તેનો સામનો કેવી રીતે કરશો એની પૂર્વયોજના કરવી બહુ જ અઘરી છે. વળી ખરેખર હુમલો થાય ત્યારે તમારું વર્તન કેવું હશે તે અંગે કોઈ અનુમાન કરવાનું શક્ય નથી. કેટલીક વાર સ્વીઓ ખૂબ હિંમતથી અકલ્ય રીતે સામનો કરી શકે છે. (જેની તેને પોતાને પણ કદી ખબર ના હોય તેવું સામર્થ્ય બતાવી શકે છે.) તો ક્યારેક આવો હુમલો થાય ત્યારે વિરોધ કે સામનો કરવાનું તો દૂર રહ્યું, તે પોતાની જગાએથી ખસી પણ નથી શકતી કે બૂમ પણ નથી પાડી શકતી ! ઇતાં આ અંગે સ્વસ્થતાથી આગોતરું વિચારી રાખો તો તમે વધુ સારી રીતે તેનો સામનો કરી શકશો. તમે આટલું તો કરી જ શકશો.

- \* તેની સામે રડવાનો કે વિનંતી કરવાનો કે આજીજી, કરગરવાનો, કાકલૂઢી કરવાનો કોઈ અર્થ નથી.
  - \* તેની તરફ ધ્યાનથી જુઓ એ વચ્ચે વચ્ચે બે ધ્યાન બને તો તમે છટકી જઈ શકો.
  - \* પૂરી હિંમતથી તમે તેને પડકારો, બૂમ પાડો, લાતો મારો કે યુક્તિપૂર્વક વર્તો જેથી એને ધ્યાત આવી નથી કે તમે સહેલાઈથી એની જબરજસ્તી સહી લો તેમ નથી.
  - \* તમે એને ઓળખતા હોવ તો તેની સાથે વાત કરો કે તે કેટલું ખરાબ કામ કરી રહ્યો છે.
  - \* જે કોઈ અન્નાણો માણસ હોય તો તમે તેનો સામનો કરતા કરતા ધ્યાનથી જેઠિને યાદ રાખી લો કે તે કેવો દેખાય છે, ઓળખ ચિનહો ક્યા છે, કેવા કપડાં પહેર્યા છે વગેરે. આ માહિતી તમારે પોલીસને કે બીજને આપવી પડશો.
  - \* યુધ્ય કે રમખાણોની પરિસ્થિતિમાં સ્વીઓના બળાત્કાર કરી મારી નાંખવું વધુ સહેલું હોય છે ત્યારે જેટલો સામનો કરવો તે તમારે જાતે જ નક્કી કરવાનું છે.
  - \* જે ધણા માણસોએ તમારી ઉપર હુમલો કર્યો હોય તો તે વખતે તેમની સાથે લડવાને બદલે નાસી જવું વધુ સારું છે.
- આમ બચવાનો કોઈ ઉપાય ન હોય ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય તેમ કરવું તમારા હાથમાં છે.



## બળાત્કાર અને જાતીય હિંસા

### ૫.૦ જ્યારે કોઈ સ્ત્રી પર બળાત્કાર થયો હોય ત્યારે

- વિચાર કરો \*
- \* મદદ માટે કોની પાસે જશો ?
  - \* બળાત્કારીને સજી કરાવવા ઈચ્છો છો ?
  - \* પોલીસ ને જણા કરવી છે કે નહીં ?
  - \* તબીબી સારવાર માટે ક્યાં જશો ?

સ્ત્રીનો કોઈ પણ વાંક કે ગુનો પુરુષને બળાત્કાર કરવાનો અધિકાર આપતો નથી. તેથી લાગણી કે ગુનહા હીત લાગણીથી પોતાની જતને કોસવાનું બંધ કરો.

ધારીવાર બળાત્કારને કારણે સ્ત્રીના પતિ કે માતા-પિતા પોતે જ એટલા બધા દુઃખી હોય છે કે તેઓ સ્ત્રીને મદદ નથી કરી શકતા. અત્યારે આ સ્ત્રી ખૂબ દુઃખી છે, ગુરુસ્સામાં છે કે ડરી ગયેલી છે. તેને અત્યારે ટેકાની અને સહાનુભૂતિની જરૂર છે. તમે તેને શુભેચ્છકની સ્વસ્થતાથી મદદ કરી શકો. સામર્થ્ય આપી રક્ખે તેવા વ્યક્તિ પાસે મોકલો. જે તમારે આવી કોઈ સ્ત્રીને મદદ કરવી હોય તો આટલું કરો.

- \* આ ઘટનામાં સ્ત્રીનો વાંક નથી તેવી તેને ખાત્રી કરાવો.
- \* તેની લાગણીઓ સમજે અને તેને આશ્વાસન આપો કે હજુ જીવનમાં ધારું બધું બાકી છે અને એણે આ ઘટનાથી જુંદ્ધારી ખતમ થઈ ગાઈ એવું ના માનવું જેઠાએ.
- \* તેને સલામતિ અને અંગત ટેકાની ખૂબ જરૂર છે. આ અંગે જે તે ના ઈચ્છે તો બીજાને કહેશો નહિં.
- \* તેને તબીબી સારવાર માટે યોગ્ય જગ્યાએ લઈ જાઓ. તે ઈચ્છે તો તેની સાથે પોલીસમાં જાઓ. વકીલનો સંપર્ક કરાવી આપો, તેને માનસિક શાંતિ મળે તેવી વ્યવસ્થા કરો.
- \* બળાત્કારીને તમે ઓળખતા હો તો પણ તમે એનો બચાવ ના કરશો કારણ કે તે બીજુ સ્ત્રીઓ માટે પણ ખતરાકૃપ છે.
- \* સ્ત્રી જે પરિસ્થિતિમાં છે તેનો વિચાર કરી લો. તે કાયદો અને પોલીસમાં જવાનું નક્કી કરે તો તેને શું શું કરવાનું થઈ શકે તેનો ખ્યાલ આપો. પોલીસ ફરિયાદ કરવાથી તેને વધુ નુકસાન તો નથી થવાનું, તે વાતનો વિચાર તેની સાથે બેસીને કરી લો.
- \* જે તમારે બળાત્કારની પોલીસ ફરિયાદ કરવી હોય તો જેટલું બને તેટલું વહેલા પોલીસથાણે પહોંચો. પહેલાં નહાઈ ના લેશો કે અંગત ભાગો ધોઈ ના નાંખશો. જે કપડાં બદલો તો ઘટના વખતે પહેરેલા કપડા ધોવા નહિં. તેને થેલીમાં ભરી સાથે લઈ જાઓ. પોલીસથાણીએ જે તપાસ માટે મોકલે તો, સ્ત્રી ડૉક્ટર પાસે મોકલે તે માટે પ્રયત્ન કરો.



- \* જે તમે તાત્કાલિક પોલીસ થાણે ના જઈ શકતા હો તો પણ સરકારી કેન્દ્ર પર જઈ પૂરેપૂરી તપાસ કરાવો. ત્યાં કહો કે બળાત્કાર થયેલો છે. ત્યાં તખીબ તમને થયેલા નાના મોટા ચીરા કે ધા અંગે વિગતે નોંધ બનાવે તેનું ધ્યાન રાખો.



- \* આપણા કાયદા પ્રમાણે તમે એક વાર પોલીસ ફરિયાદ કરો એટલે બળાત્કારીએ પૂરવાર કરવાનું રહે છે કે તેણે બળાત્કાર નથી કર્યો. માટે જે તમે બળાત્કારીને ઓળખતા હોય તો તમારી પોલીસ ફરિયાદમાં એ વાત સ્પષ્ટતાથી તખાવો. પોલીસ એ વ્યક્તિની ઘરપકડ કરશો અને તમને તેની ઓળખ કરવા થાણે બોલાવશે.
- \* જે કે પોલીસ ફરિયાદમાં તમારી પર બળાત્કાર થયો તે સમયની આખી ઘટનાનું પૂરેપુરું વર્ણન કરવાનું રહે છે. ઘણીવાર આ વાત વારંવાર જુદા જુદા અધિકારીઓ અને ન્યાયધીશ સામે વિગતે કહેવી પડે છે. કેટલીકવાર આ પ્રસંગો માનસિક રીતે પીડાદાયક હોય છે. વળી ઘણીવાર આ ઘટના અંગે વિચિત્ર પ્રશ્નો પણ કરવામાં આવે છે. જેના જવાબ આપવાના સીને માટે તકલીફકારક હોય છે. તેથી બને ત્યાં સુધી આવા કેસ લડવા માટે કોઈ વકીલ કે સમાજસેવક અથવા સંસ્થાની મદદ લેવી. આવી કોઈ પણ કાર્યવાહી વખતે કઢી એકલા ના જશો.


- \* તમે જે ઇચ્છો તો આ કેસ ચલાવતી વખતે ત્રાહિત વ્યક્તિઓ હાજર ના હોય તેવું પણ ગોઠવી શકાય. તમારા વકીલ આ અંગે તમને મદદ કરશો.



**જે તમે સામાજિક કાર્યકર કે આરોગ્ય કાર્યકર હો તો**

\* બળાતકાર થયેલી સ્વી તરફ પૂરી સહાનુભૂતિ અને સમજણ હેખાડો : તમારા કોઈ પણ વર્તનથી તેને વધુ દુઃખ થાય તેવું ના કરશો.

\* તેની આરોગ્ય સમસ્યાઓ ઉક્કો : તેને જાતીય રોગ લાગુ પડ્યો હોય તો દવા આપો. બળાતકારથી જે તે સગર્ભા હોય તો તેને આગળ શું કરવું છે તે બાબતે નિર્ણય કરવામાં તેને મદ્દદ કરો.



\* તેના પર થયેલ અત્યાચારની તમામ વિગતો નોંધો : શરીરનું આગળનું અને પાછળનું ચિત્ર બનાવી ક્યાં ક્યાં અને કેવી ઠણાઓ થઈ છે તે લખો. તે જણાવે તે બધી વિગતો નોંધી લો. તેને બતાવો તમે શું લખ્યું છે અને સલાહ આપો કે જે તે કાયદાકીય કાર્યવાહી કરવા દર્શાવે તો તમારી નોંધ તેને ઉપયોગી થઈ શકે છે.

\* તેની દાક્તરી તપાસ માટે ગોઠવણ કરો.

\* તેને કાનૂની સલાહ અને ટેકાની જરૂર હોય તો તેની ગોઠવણ કરો.

\* તેની માનસિક જરૂરિયાતો તરફ ધ્યાન આપો : તેનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ પાછું આવે તે માટે પ્રયત્ન કરો. તેના મનમાં પોતે ગુનેગાર છે એવી લાગણી હોય તો તે દૂર કરો.

\* તેને આગળ ઉપર કાયદાકીય કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં તથા તેનો અમલ કરવામાં મદ્દદ કરો.

\* તેને તેના કુટુંબ સાથે આ ઘટના અંગે વાત કરતાં ખચકાટ થતો હશે. તમારી મદ્દથી તે પોતાના પતિ કે માતા-પિતાને આ વાત કહી શકશે. યાદ રાખો કે તેના કુટુંબીજનોને પણ આ ઘટનાથી આધાત લાગશે અને તમારે તેમને પણ મદ્દદ કરવી પડશે.

\* તેની સામાજિક અને આર્થિક સ્થિરતા માટે પ્રયત્ન કરો.

#### ૬.૦ બળાત્કારથી નીપજતી આરોગ્ય સમસ્યાઓ

- \* બળાત્કાર પછી તરત જ (૭૨ કલાકમાં) ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી ગર્ભ રહેતો નથી.
- \* ગર્ભ રહી ગયો હોય તો ચ અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવવો સલામત છે. આપણા દેશનો કાયદો તેમને આ અધિકાર આપે છે.
- \* બળાત્કાર દરમિયાન ગુપ્તાંગમાં થયેલ ઇન્જનોને કારણે બળાત્કારીને થયેલો જતીય રોગ સ્ત્રીને સહેલાઈથી લાગે છે. જે તે અંગના ચિનહોની તપાસ કરાવી સારવાર લો.
- \* નીચેના ભાગોમાં થયેતા સામાન્ય ધા, ચીરા, વગેરે માટે જરૂર મુજબ સારવાર લો. દિવસમાં બે-ત્રણવાર ધા-ચીરા વગેરે બરાબર સાફ કરો. લીમડો ઉકાળીને તેના પાણીથી ધા-ચીરા ધોવાથી ફાયદો જરૂર થાય છે. જે કોઈ જગાએ ચેપ લાગે તો તેની યોગ્ય સારવાર કરાવો. કેટલીકવાર બળાત્કાર પછી મૂત્રમાર્ગનો ચેપ ઘણી સ્ત્રીઓને થાય છે માટે તે અંગે સંજન રહી સારવાર કરાવો.
- \* બળાત્કાર પછી પતિ સાથે ફરી જતીય સંબંધમાં ગોઠવાતા વાર લાગે છે. આવા સંજેગોમાં પતિને ધીમે રહીને સમજલવો.


બળાત્કાર અંગે વિવિધ લાગણીઓ પર કાબૂ મેળવવાનું અધિક છે.

બળાત્કાર માટે સ્ત્રીના મનમાં વિવિધ પ્રતિક્રિયાઓ આવે છે. તે બધામાંથી બહાર નીકળીને પાછું સામાન્ય જીવન જીવવા માંડવાનું અધિલું ઇતાં જરૂરી છે. સ્ત્રી પર થયેતા બળાત્કારમાં પોતે ગુનેગાર છે તેવી લાગણી તે જેટલી વહેલી છોડી દે તેટલું વધુ સારું. જુદી જુદી સ્ત્રીઓને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવે છે. જેમ કે, કેટલીક સ્ત્રીઓને ખૂબ ગુસ્સો આવે છે. તેઓ માટે બળાત્કારીને શિક્ષા આપવાનું એ જ જીવનનું ધ્યેય બની જાય છે. કેટલીક સ્ત્રીઓ માનસિક આધાતથી સૂનમૂન થઈ જાય છે. કેટલીક સ્ત્રીઓ સતત દુઃખી અને બાકીના જીવન પ્રત્યે ફરિયાદની લાગણી લઈ જવે છે. તો કેટલીક સ્ત્રીઓ બળાત્કાર જેવી ઘટનાથી બીજુ બેનોને કેમ બચાવી શકાય તેવા પ્રયત્નો કરે છે. તમે પણ તમારી રીતે તમારો નિર્ણય કરી શકો છો પણ આ સંજેગોમાં જેમની પર તમને વિશ્વાસ હોય તેવા વ્યક્તિ સાથે ચર્ચા કરવાથી વધુ સ્પષ્ટતા આવશે.

જતીય સંબંધ માટે હજુ હું  
પૂરેપૂરી રીતે તૈયાર નથી.  
હજુ આપણે થોડી રાહ  
જેઠાં તો સારું.




## બળાત્કાર અને જાતીય હિંસા



### ૭.૦ પરિવર્તન માટે પ્રયાસ :

બળાત્કાર દ્વારા સમાજમાં થાય છે. તેને અટકાવવા ખૂબ મુશ્કેલ છે. છતાં બળાત્કાર ના થાય તેવા સંજ્ઞેગો લાવવા આપણે સૌઅને પ્રયત્ન કરવાનો છે. તેનું પ્રથમ પગથિયું સમાજમાં સ્વી-પુરુષ સમાનતાનું મૂલ્ય સ્વીકારાય તે છે. છતાં બળાત્કારની સમસ્યાનું નુકશાન નીવારવા આપણે નીચે જળાવેલા પ્રયત્નો પણ કરી શકીએ.

- \* જે તે વિસ્તારના લોકપ્રતિનિધિ, અધિકારીઓ, ધર્મગુરુઓ પરિવર્તનની પ્રક્રિયામાં જોડાય તે માટે પ્રયત્ન કરીએ.
- \* ડૉક્ટરો, આરોગ્ય કાર્યકરો તથા અન્ય સેવાઓમાં સ્વીને સહાનુભૂતિવાળું વલણ મળો, આવા ખરાબ અનુભવમાંથી પસાર થયેલ સ્વીને આરોગ્ય સમસ્યાઓમાં સારવાર બરાબર મળી રહે તે જેવું જોઈએ.
- \* સ્વીઓ અને છોકરીને આત્મસુરક્ષાના દાવ શીખવાડો.
- \* બળાત્કાર થયેલ સ્વીઓને કાયદાનો ઉપયોગ કરતાં શીખવો.
- \* છોકરા-છોકરીઓ એકબીજ માટે માનની નજરે જુએ તે માટે શૈક્ષણિક કાર્યક્રમો વખતો વખત યોજવા જોઈએ.
- \* બળાત્કારી વ્યક્તિ બીજી સ્વીઓને હેરાન ના કરે તે માટે તેના ઘર સામે ઘરણા, દિવાલો પર સૂત્રો લખવા, પત્રિકાઓ આપવી, વગેરે કાર્યક્રમો પણ તમે લઈ શકો.



### બળાત્કારીનો સામૂહિક વિરોધ કરો.

ચાલીસ વર્ષના રેખાબેનને કોઈકે બળાત્કાર કરીને ચાકુથી જીવલેણ ઠંડું કરી જંગલમાં ફેંકી દીધા હતા. તે દિવસે સવારે ગોવાળિયા છોકરાઓએ તેને દ્વારાને પહોંચાડી. તેણે ભરતાં પહેલાં બળાત્કારીનું નામ આપ્યું. પોલીસો તેને પકડીને લઈ ગયા. પણ તરત જ બપોરે તે છૂટીને પાછો આવી ગયો. તે રોકુથી ગામના બજારમાં ફરતાં ફરતાં ગમે તેમ બોલવા લાગ્યો તથા બીજી સ્ત્રીઓને પણ ઉરાવવા માંડયો.

આ જેઠી ગામની બીજી સ્ત્રીઓને ખૂબ દુઃખ થયું. તેઓ બધા રાત્રે ભેગા મજ્યા અને નક્કી કર્યું કે તેઓ જમીનદારના ખેતરમાં કામ કરવા નહીં જાય. જ્યાં સુધી આ માણસને શિક્ષા ના થાય ત્યાં સુધી તેઓ પોતાની હડતાળ ચાલુ રાખશે. બીજે દિવસે સવારે ઘણી બધી સ્ત્રીઓએ ભેગા થઈ સરધસ કાઢ્યું અને જમીનદારના આંગણે જઈ ઉપવાસ પર બેસી ગઈ. આથી જમીનદાર ગુસ્સે ભરાયા. પોલીસને બોલાવીને જબરદસ્તીથી બેનોને ઉઠાડી મૂકી. બેનોએ તેમના ઘર તરફ જતા રસ્તા પર ઝાડ નીચે બેસી ઉપવાસ ચાલુ રાખ્યા. જમીનદારના કુટુંબની સ્ત્રીઓ પોતાના પતિઓને તો કાંઈ કહી શકે તેમ ન હોતી પણ તેમનામાંથી કેટલીક સ્ત્રીઓ ઉપવાસી બેનોની સાથે જેડાઈ ગઈ. આખો દિવસ અને રાત સતત પાંચ દિવસ સુધી ભૂખી રહેવાથી છેવટે આ બધું સાંચું નથી હેખાતું એમ લાગતાં જમીનદાર કોમના વડીલોએ બેનો સાથે વાતચીત કરવાની પહેલ કરી.

બેનોએ તેમની સાથે શાંતિથી ચર્ચા કરી અને મક્કમતાથી બળાત્કારીને શિક્ષા થવી જેઠાએ તેવી રજૂઆત કરી. જમીનદાર કોમના વડીલોએ તેમનું પંચ બેસાડ્યું અને બળાત્કારીને મોટી રકમનો દંડ કર્યો. રેખાબેનની મોટી દીકરીના લગ્નનો ખર્ચ રૂ. ૨૫,૦૦૦ વસૂલ કરીને રેખાબેનની દીકરીને અને તેના પિતાને આપ્યો.

બેનોની આ પહેલી જીત હતી. ડ્રિપિયાનો દંડ તો ઠીક પણ શાતિપંચ બેસવાને કારણે બળાત્કારીની આબરુ ગઈ. આખા પંથકમાં લોકોએ તેને ધિકાર આપ્યો અને તેને લગ્નમાં કોઈ પોતાની દીકરી ન આપે એટલી હદ સુધી સામાજિક ફિટકાર મળ્યો.

આ બધું બેનોએ ભેગા થઈને મક્કમતાથી પોતાથી બળવાન અને વગદાર માણસોનો સામનો કર્યો તેથી જ થઈ શક્યું.





એને જવા ના દેશો.....!! એને જવા ના દેશો.....!!  
બળાત્કાર કરનાર ગુનેગાર છે.  
ભોગ બનનાર સ્ત્રીને દોષી ના ગણો.  
છેડતી, શારીરિક સતામણી કે બળાત્કાર  
થયેલ છોકરીને મદદ કરો

---